

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ = ૨૦૧૮પ્રા.શાળા, સી.આર.સી

- ગુજરાત સરકારના શિક્ષણનાં મહાકુંભનો અમીઘૂંટડો એટલે શાળા પ્રવેશોત્સવ.પોતાના જીવનમાં શિક્ષણનાં પગથીયે પહેલી પગલી માંડતા ભૂલકાઓનો આગવો અવસર એટલે પ્રવેશોત્સવ.તો આજ રોજ આપણી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ = ૨૦૧૮ ઉજવાઈ રહ્યો છે ત્યારે શાળા પરિવાર વતી આપ સર્વેનું અત્રે ઉષ્માભર્યું હાર્દિક સ્વાગત છે.આજના આ પવિત્ર પ્રસંગે પ્રાંગણ શોભાવનાર પ્રભુના પયંગબરો એવા બાળકોના આગમન પ્રારંભે આપણા પ્રવેશોત્સવની કાર્યક્રમની શરૂઆત કરીએ.

(૧) કાર્યક્રમનાં શ્રી ગણેશ મનુષ્યના ગૌરવગાન સાથે કરીએ. (૦૫ મિનીટ)

“મનુષ્ય તું બડા મહાન છે ”

(૨) યોગ પરિચય અને નિદર્શન (૦૩ મિનીટ)

શાળાનાં વિદ્યાર્થીઓ આપણી સમક્ષ યોગ ક્રિયાઓ કરશે જેને આપણે નિહાળીએ

● દીપ પ્રાગટ્ય

“જાત બાળીને ખુદની દે છે ઉજ્જવળ પ્રકાશ

દન્ય,દન્ય એ દીપને,દિવ્ય જીવનમાં વાસ ”

તો મંચસ્થ મહેમાનોને વિનતી કરૂ કે તેઓ અમારી શાળામાં આજનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકે.

(૩) મહેમાનોનું પુસ્તક દ્વારા સ્વાગત – પરિચય (૦૫ મિનીટ)

“મહેમાનોના વધામણા દિલથી અમે આપીએ

સ્વાગત કરી અહી, તમને અમે નવાજીએ

આપણે રૂડી-રૂડી, રંગોળી અમે પુરાવીએ

આપણે સાથે મળી, આ અવસરને દીપાવીએ ”

તો આજે પધારેલ મહેમાનોનું પુસ્તક દ્વારા સ્વાગત કરી આપણી ગુર્જર પરંપરાને નિભાવી લઈએ.

મહેમાનશ્રીઓ . ૧.

૨.

૩.

૪.

૫.

૬.

૭.

૮.

૯.

૧૦.

(૪) નામાંકન વિધિ :- (૦૭ મિનીટ)

નાની –નાની પા..પા..પગલી આજે આ શાળાના યોગાનમાં પાડવાની છે. જેમના મીઠા અને માસૂમ કલરવથી આ શાળાને એક રંગીન વાતાવરણ મળવાનું છે. જેના જીવનમાં શિક્ષણનું પ્રથમ સોપાન કંડારવા જઈ રહ્યું છે તેવા પ્રવેશ મેળવતા આજે બાળકોને હુફ થી આપણે વધાવીએ અને આપના શિક્ષણનાં રંગે રંગાવીને શિક્ષણનાં ભગીરથ કાર્યમાં જોડી દઈ એક નૂતન પેઢી ઘડીએ.

- તો મહેમાનોને વિનંતી છે કે આજે તેઓ જે શુભ આશયથી જે શુભકાર્ય કરતા આવ્યા છે તે પોતાના વરદ હસ્તે પ્રારંભે. અને આ પુણ્યનું કાર્ય કરી નાના બાળકોને શુભ શિક્ષણ પ્રવેશ કરાવે.
- આંગણવાડીનાં બાળકોનો પ્રવેશ.
- ધોરણ – ૧ નાં બાળકોનો પ્રવેશ.
- ધોરણ ૮ ના બાળકોનો પ્રવેશ.

આભાર મહાનુભાવોનો કે પોતાના શુભા હસ્તે આ નાના ભૂલાકાની શિક્ષણ સફરને ઉત્થાન કરી પુનઃ આભાર સર્વેનો

(પ) દેશભક્તિ ગીત (૦૫ મિનીટ)

તો આજના આ પાવન પ્રસંગે અમારી શાળાના બાળકો આપના દેશભક્તોને અર્પણ એવું દેશભક્તિ ગીત રજુ કરશે .જેને આપણે હૃદય થી માણશું.

(ક) વિદ્યાલક્ષી બોન્ડ વિતરણ (૦૩ મિનીટ)

આજના પ્રસંગે ધોરણ ૧ માં પ્રવાસ પામેલ બાળાઓને મહેમાનો વિદ્યાલક્ષ્મી બોન્ડ અર્પણ કરશે.

(ગ) શિષ્યવૃત્તિ વહેચણી :- (૦૩ મિનીટ)

સરકારશ્રી દ્વારા બાળકોની મળતી સહાય પેટે શિષ્યવૃત્તિની ચુકવણી પધારેલ મહેમાનોના હસ્તે કરીશું.

૧.

૨.

૩.

(ઁ) સાચકલ વિતરણ (૦૩ મિનીટ)

ધોરણ ૮ પાસ કરી ધોરણ ૯ માં પ્રવેશ કરેલ બાળાને પ્રોત્સાહન રૂપે સાચકલ વિતરણ મહેમાનો કરશે.

૧.

૩.

૫.

૨.

૪.

૬.

(૯-૧) ધોરણ ૩ થી ૮ નાં ૧,૨,૩ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન (૦૩ મિનીટ)

“ કલ્પના કી દુનિયા હર કોઈ બનાતા હૈ

લેકિન પાતા વહી હૈ, જો તકદીર લેકે આતા હૈ ”

આવા તેજસ્વી વિદ્યાર્થીઓ જે આ શાળાનાં ચમકતા સિતારા છે જેઓ આ ગામનું ગૌરવ છે તેવા પોતાની કક્ષામાં પ્રથમ ક્રમે ઉત્તીણ થનાર વિદ્યાર્થીઓનું સ્વાગત પણ અત્રે પુસ્તક આપીને કરવામાં આવશે.

(ધોરણ :-૩) ૧.

(ધોરણ :-૪) ૧.

(ધોરણ :-૫) ૧.

(ધોરણ :-૬) ૧.

(ધોરણ :-૭) ૧.

(ધોરણ :-૮) ૧.

(૯ - ૨) દાતાશ્રીઓનું સન્માન (૦ ૨ મિનીટ)

દાતાઓ સમાજની શોભા અને ગામનું આગવું ગૌરવ છે, આવા પુણ્યશાળી હૃદય શાળાને સમાજને અવાર-નવાર અન્યોન્ય રીતે મદદ કરી જાય છે.ત્યારે તેઓનું પણ સન્માન કેમ કરી ચૂકાય....

૧.

૨.

૩.

૪.

૫.

૬.

(૯ - ૩) વિદ્યાર્થીનું વક્તવ્ય અમૃતવાણી :-

(૦૫-મિનીટ)

શબ્દ એ આ સંસારની કોમળ ચીજ છે ત્યારે જ કોઈ કવિએ ભાગ્યશાળી હૃદય માટે કહ્યું છે કે
“મળે છે શબ્દોની જાગીર ભાગ્યવંતોને” આવા નીખારની વાત જ કે અનોખી હોય છે.

અત્રે આ પ્રવેશોત્સવ પ્રસંગે આપણી સમક્ષ આ શાળાના વિદ્યાર્થીઓમાંથી

..... અમૃત વચન રજુ કરશે.

જેમનો વિષય છે

● મહેમાનોનું ઉદબોધન :- (૦૫ મિનીટ)

“દુખની ઉડાડે ધૂળ તે શેતાન હોય છે.

સુખનું વહાવે ઝરણું તે ભગવાન હોય છે

બંનેનો મેળ શોધી જે નીપજાવે જીંદગી

મારું માનવું છે તે ઈશ્વાન હોય છે”

આજે આપણે આંગણે પવિત્ર પ્રસંગ એવા પ્રવેશોત્સવ કાર્યક્રમને શોભાવવા મહેમાનશ્રીઓ

પધાર્યા છે તો તેઓના આશીર્વાચન આપણને મીઠી વીરડી સમાન છે, તો ૧.

----- પોતાના આશીર્વાચન પાઠવશે.

● સમાપન વિધિ (૦૨ મિનીટ)

“શબ્દોને સાચા સ્વરૂપે પામવા

મૌનને આકાર હોવો જોઈએ

સૌ મિલનનો અંત આવે એ પડે

આંખમાં આભાર હોવો જોઈએ ”

તો આજના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૧૪ ના આ કાર્યક્રમની

આભાર વિધિ કરશે. તો

.....વિનંતી કે આ

કાર્યક્રમની આભાર વિધિ કરે.

- **પુસ્કારોપણ**

પ્રવેશોત્સવ કાર્યક્રમની પૂર્વ સંઘ્યાએ પર્યાવરણ વિશેની અવર્નેશ કેળવાય તે હેતુસર અને “છોડ માં રણછોડ” જોવાની દષ્ટિ નાના બાળકોમા બાળપણથી કેળવાય તે હેતુસર કાર્ય સિદ્ધિના ભાગરૂપે શાળાના પટાંગણમાં મહેમાનોના શ્રી હસ્તે પુસ્કારોપણ કરીએ.

તો મહેમાનોને વિનંતી કે તેઓ શાળાના પટાંગણમાં વુક્ષ વાવેતર કરે.

રાષ્ટ્રગીતનું ગાન :-

તો આપણે સૌ આપણા રાષ્ટ્રને માન આપવા માટે એક સાથે પોતાની જગ્યા ઉપર ઉભા થઈ રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કરીશું.

આપ સર્વેનો ફરીથી શાળા પરિવાર વતી ખુબ-ખુબ

આભાર ...

“ભારત માતા કી જય”

જરૂરી નોંધ: કાર્યસૂચી માં ફેરફાર શક્ય છે.તો જરૂરી ફેરફાર કરી આ ફાઈલ નો ઉપયોગ

કરવા વિનંતી છે.એક નમુના રૂપે આ ફાઈલ બનાવેલ છે.

આભાર મિત્રો.....